

Hands on training on Bio-pesticides and Bio-agents production and its use in Agriculture

જાહેરનામું

નંબર. ૯૨૬/૨૦૨૩

આથી સંબંધકર્તા સર્વેને જાણ કરવામાં આવે છે કે તા. ૨૬/૦૯/૨૦૨૩ ના રોજ નવસારી ખાતે મળેલ વિદ્યાપરિષદની ૫૦મી બેઠકની કાર્યનોંધના મુદ્દા નંબર ૫૦.૨૦ થી નીચેની વિગતે ઠરાવ કરેલ છે.

It is resolved to start "hands on training on Bio-pesticides and Bio-agents production and its use in agriculture" at College of Agriculture, Bharuch as appendix – A.

જા.નં.ન.કૃ.યુ./એકોભ/૨૪૭૩-૭૧/૨૦૨૩

તા.૨૦ / ૧૨ / ૨૩



આચાર્ય

કોલેજ ઓફ એગ્રીકલ્ચર
નવસારી કૃષિ યુનિવર્સિટી,
ભરૂચ

નકલ સવિનય રવાના :-

૧. વિદ્યાપરિષદના તમામ સભ્યોશ્રીઓ તરફ
૨. યુનિવર્સિટીના તમામ અધિકારીશ્રીઓ તરફ
૩. તમામ આચાર્યશ્રી તરફ

નકલ રવાના :-

૧. માન.કુલપતિશ્રીના રહસ્ય સચિવશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી
૨. કુલસચિવશ્રીના રહસ્ય સચિવશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી
૩. આ કચેરીની તમામ શાખાઓ તરફ
૪. જાહેરનામા ફાઈલ

**Hands on Training on Bio- pesticides and Bio-agents Production and Its Use in Agriculture
: (0+10)**

Department of Plant Pathology, College of Agriculture, NAU., Bharuch

Period	Content of Hands on Training																																					
1 st Week	<p>Conceptualization of basic aspects of this training through orientation programme</p> <ol style="list-style-type: none"> 1) Experiential Learning Programme 2) Entrepreneurship Development 3) Cost Benefit Analysis of Bio Pesticides and bio agents 4) Management, Administration and preparation of Project report <p>Faculties of Plant Pathology will exploring the basic information by conducting on and off farm visits to various Bio-pesticides units.</p>																																					
2 nd Week to 9 weeks (All the practical will be taken alternatively)	<p>Bio Pesticides and Bio agents Production technology</p> <ul style="list-style-type: none"> • Opportunity analysis, background and context of Bio -Pesticides • To know the Bio-Pesticides and its importance • Mass Multiplication of Bacterial bio-agent • Mass Multiplication of Fungal bio-agent • Preparation of Bio-Pesticides and bio agents • Care to be taken during preparation of Bio-Pesticides and bio agents • Enriched with bio fertilizer mixing • bagging, packing and storage • Marketing/Linkages • To find out the cost, gross profit and net profit • Application of Bio-Pesticides in important crops of this area 																																					
10 th Week	<p>Evaluation</p> <p>The HoD will form a committee of three members of the discipline and will evaluate the enrolled students by considering the following aspects.</p> <table border="1"> <thead> <tr> <th>Sr.</th> <th>Aspects of Evaluation</th> <th>Marks</th> </tr> </thead> <tbody> <tr> <td>1</td> <td>Project planning & Writing</td> <td>10 marks</td> </tr> <tr> <td>2</td> <td>Presentation</td> <td>10 marks</td> </tr> <tr> <td>3</td> <td>Regularity</td> <td>10 marks</td> </tr> <tr> <td>4</td> <td>Monthly assessment</td> <td>10 marks</td> </tr> <tr> <td>5</td> <td>Output delivery</td> <td>10 marks</td> </tr> <tr> <td>6</td> <td>Technical skill development</td> <td>10 marks</td> </tr> <tr> <td>7</td> <td>Entrepreneurship skill</td> <td>10 marks</td> </tr> <tr> <td>8</td> <td>Business Networking skill</td> <td>10 marks</td> </tr> <tr> <td>9</td> <td>Report writing skill</td> <td>10 marks</td> </tr> <tr> <td>10</td> <td>Final presentation</td> <td>10 marks</td> </tr> <tr> <td colspan="2" style="text-align: right;">Total</td> <td>100 marks</td> </tr> </tbody> </table>		Sr.	Aspects of Evaluation	Marks	1	Project planning & Writing	10 marks	2	Presentation	10 marks	3	Regularity	10 marks	4	Monthly assessment	10 marks	5	Output delivery	10 marks	6	Technical skill development	10 marks	7	Entrepreneurship skill	10 marks	8	Business Networking skill	10 marks	9	Report writing skill	10 marks	10	Final presentation	10 marks	Total		100 marks
Sr.	Aspects of Evaluation	Marks																																				
1	Project planning & Writing	10 marks																																				
2	Presentation	10 marks																																				
3	Regularity	10 marks																																				
4	Monthly assessment	10 marks																																				
5	Output delivery	10 marks																																				
6	Technical skill development	10 marks																																				
7	Entrepreneurship skill	10 marks																																				
8	Business Networking skill	10 marks																																				
9	Report writing skill	10 marks																																				
10	Final presentation	10 marks																																				
Total		100 marks																																				